

સેમેસ્ટર 1- દ્વિવ નોંધી નામા પદ્ધતિ-1 અસાઈમેન્ટ

સ 1) નેશનલ રેડીયો કંપનીએ સ્ટાર રેડિયો સર્વિસનેતા 1-3-2010 ના રોજ 600 રેડિયો સેટ આડત પર વેચવા મોકલ્યા. દરેક રેડિયોની ભારતિયા કિંમત રૂ. 1,000 હતી. કાયું ભરતિયું ભારતિયા કિંમત પર 25% નફોમળે તે કિંમતનું બનાવવામાં આવ્યું હતું. નેશનલ રેડીયો કંપનીએ ગાડી ભાડાના રૂ.1,500, નૂરના રૂ. 22,500 અને વીમાના રૂ.18,000 ચુકવ્યા હતા.

સ્ટાર રેડિયો સર્વિસે રૂ 1,00,000ની ચાર માસની મુદતની લૂંડી સ્વીકારીને પરત કરી જે નેશનલ રેડીયો કંપનીએ એક માસ પછી 12%ના વટાવે બેંકમાં વટાવી. રસ્તામાં 30 રેડિયો આગ લાગવાથી નાશ પામ્યા. જેનો વીમા કંપનીએ રૂ.20,000નો દાવો સ્વીકાર્યો. સ્ટાર રેડીઓએ 430 રેડિયો દરેક રૂ .1050ની કિંમતે, 50 રેડિયો દરેક રૂ. 1,100ની કિંમતે દેસાઈને ઉધાર તથા 30 રેડિયો દરેક રૂ.1080ની કિંમતે નેશનલ રેડીયો કંપનીની ભલામણ અને જવાબદારીથી સોલંકીને ઉધાર વેચ્યા હતા. માલ છોડાવતા રૂ.5,700 જકાતના અને રૂ.3,000 વેચાણખર્ચ ના ચુકવ્યા હતા. દેસાઈ પાસેથી રૂ.5,000 વસૂલ થઈ શકતા નથી જે માંડી વાડવામાં આવ્યા અને સોલંકી નાદાર જાહેર થવાથી 90% રકમ વસૂલ થઈ શકી.

સ્ટાર રેડિયો સર્વિસને વેચાણ પર 5% કમિશન અને ઉધાર વેચાણ પર 2% આસામી આડત આપવાની છે. 30 રેડિયોને નુકશાન થયેલ છે જેનો રિપેરિંગ ખર્ચ રૂ.2000 થશે.

નેશનલ રેડીયો કંપનીના ચોપડામાં આડતમાલ ખાતું અને સ્ટાર રેડિયો સર્વિસનું ખાતું તૈયાર કરો.

S2) અમદાવાદની રૂપલ એજન્સીની ધોરાજીમાં એક સ્વતંત્ર શાખા છે. શાખાનું તા. 31-3-2012ના રોજનું કાયું સરવૈયું નીચે મુજબ છે.

વિગત	ઉધાર બાકી	જમા બાકી
માલનો શરૂનો સ્ટોક	75,000	-
મુખ્ય ઓફિસથી મળેલ માલ	2,25,000	-
મુખ્ય ઓફિસને પરત કરેલ માલ	-	30,000
મુખ્ય ઓફિસનું ખાતું	-	2,25,000
ખરીદી અને વેચાણ	2,25,000	5,40,000
માલ પરત	30,000	15,000
નૂર અને જકાત	15,000	-
પગાર (તા 28-2-12 સુધી)	33,000	-
મજૂરી	12,000	-
ઘાલખાંધ અને ઘાલખાંધ પરત	3,000	7,500
દેવાદારો અને લેણદારો	1,32,000	60,000
રોકડ અને બેન્ક	7,500	22,500
10%ની ભારત સરકારની જમીનગીરીઓ (દા.કિ.રૂ. 1,50,000, ખરીદા તા.1-10-11)	1,42,000	-
	9,00,000	9,00,000

વધારાની માહિતી:

- 1) આખર માલના સ્ટોકની કિંમત રૂ 1,00,000
- 2) માર્ગસ્થ માલ રૂ.30,000 અને માર્ગસ્થ રોકડ રૂ.60,000
- 3) તા.1-10-11ના રોજ રૂ.80,000ની કિંમત ફર્નિચર મુખ્ય ઓફિસ દ્વારા શાખાને મોકલવામાં આવ્યું હતું. ફર્નિચર પર વાર્ષિક 10% લેખે ઘસારો ગણવામાં આવે છે.
- 4) ઉપરની માહિતી પરથી ધોરાજી શાખાના વાર્ષિક હિસાબો તૈયાર કરો.

સ3) મેસર્સ કોમલ બ્ર.મહેરવાડાના ગોડાઉનમાં 31-1-11ના રોજગ લાગવાથી બધો માલ બળી ગયો, નીચેની માહિતી પરથીવીમા કંપની સમક્ષ રજૂ કરવા દાવાનું પત્રક તૈયાર કરો.

વિગત	2008	2009	2010	2011
શરૂનો સ્ટોક	81,270	97,200	1,08,000	1,10,700
	2,24,700	2,40,000	2,43,000	18,000

ચોખ્ખી ખરીદી	3,60,000	3,96,000	4,20,000	36,000
વેચાણ	52,200	57,000	62,700	6,000
મજૂરી	97,200	1,08,000	1,10,700	-
આખર સ્ટોક				

આખરનો સ્ટોક હંમેશા મૂળકિંમત કરતાં 10% ઓછી કિંમતે આંકવામાં આવે છે. તમારી ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરો.

સ4) શ્રી શરદના ચોપડા પરથી તા. 31મી માર્ચ,2009 તથા 31મી માર્ચ2010 ના રોજની નીચેની બાકીઓ મળે છે.

વિગતો	તા.31-3-09	તા.31-3-10	
દેવાદારો		?	24,000
લેણદારો	16,000		?
સ્ટોક		?	17,000
મકાન	30,૦૦૦		30,000
યંત્રો	૬૦,000		67,000
ફર્નિચર	5,000		5,000
બેન્ક લોન	10,000		8,000
રોકડ	14,000		11,000

તા.31મી માર્ચ, 2010ના રોજ પૂરા થતાં વર્ષના રોકડ વ્યવહારો (અમુક ચોક્કસ અન્ય વિગતો સિવાય)

દેવાદારો પાસેથી વસૂલાત	93,000
ઉપાડ	10,000
યંત્રનું વેચાણ(ચોપડે કિંમત રૂ.5,000)	3,000
ધંધાના ખર્ચા	10,000
લેણદારોને ચુકવણી	61,000
રોકડ ખરીદી	16,000
પરચૂરણ આવક	2,000

અન્ય માહિતી:

- 1) વેપારી પડતર પર 33 1/3% નફો ચઢાવીને માલ વેચે છે.
- 2) લેણદારોએ આપેલ વટાવ રૂ.1000
- 3) વર્ષ દરમિયાન ઉધાર ખરીદી કુલ ખરીદીના 80% હતી અને રોકડ વેચાણ કુલ વેચાણના 10% હતું. ઉધાર વેચાણ રૂ.90,000 હતું.
- 4) યંત્રો અને ફર્નિચર પર 10% તથા મકાન પર 2% ધસારો ગણો.

ઉપર દર્શાવેલ માહિતી પરથી 31મી માર્ચ2010 ના રોજ પૂરા થતાં વર્ષનું વેપાર ખાતું અને નફા નુકશાન ખાતું તૈયાર કરો આબે પાકું સરવૈયું બનાવો.

સ5) નામા પધ્ધતિ ના ઉપયોગો જણાવો.